

ગુજરાતના શહેરો તથા અલગ-અલગ રાજ્યોમાં નકલી પોલીસ તરીકેનો સ્વાંગ રચી વૃધ્ધ સ્ત્રી/પુરૂષોને ટાર્ગેટ બનાવી સોનાના દાગીના ઉતારાવી નજર ચુકવીને ઠગાઈ/છેતરપીંડીથી મેળવી નાસી જતા “ઈરાની ગેંગ” ના આરોપીઓને ઝડપી પાડતી, સુરત શહેર કાઈમ બ્રાંચ.

સને ૨૦૧૫ થી ૨૦૧૭ ના વર્ષમાં સુરત શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં ચાલતા જતા પુરૂષ અને મહિલાઓને ત્રણ-ચાર અજાણ્યા આરોપી ઈસમો રસ્તામાં રોકી પોતે પોલીસવાળા છે તેવી ઓળખ આપી પોલીસ ચેકિંગના બહાને મહિલાઓ અને પુરૂષોના શરીર પરના સોનાના દાગીનાઓ ઉતારવા જણાવી તે દાગીના સાચવીને પર્સ/થેલીમાં મુકી દેવા સમજાવી અને દાગીના ઉતારી બાદ તેને રૂમાલ/કાગળમાં લપેટી પડીકુ બનાવી નજર ચુકવી ખોટા દાગીના પકડાવી સોનાના દાગીના ઠગાઈ કરી મેળવી ભાગી જતા હોવાની એમ.ઓ. ધરાવતા આરોપી ઈસમોને શોધી કાઢવા માટે સુરત શહેર કાઈમ બ્રાંચના પો.સ.ઈ.નાઓ તથા તેમની ટીમના માણસો સાથે વર્ક-આઉટમાં હતા દરમ્યાન તેઓને બાતમીદારો મારફતે આ એમ.ઓ.થી ગુનો આચરવામાં સંડોવાયેલ આરોપીઓ ઈરાની ગેંગના હોવાનું અને તેનો મુખ્ય આરોપી સલીમ ટકલો અને રાજ ઈરાનીનાઓ તેમના વતન મહારાષ્ટ્રના અહમદનગર જીલ્લાના શ્રીરામપુર ગામે તેમના રહેણાંક મકાને હાજર હોવાની હકિકત મળતા પો.સ.ઈ. શ્રી નાઓને ઉપરી અધિકારીશ્રીઓના જરૂરી સુચના અને માર્ગદર્શન મુજબ તેમની ટીમ સાથે શ્રીરામપુર જી-અહમદનગર મહારાષ્ટ્ર ખાતે જઈ સ્થાનિક પોલીસની મદદ મેળવી આરોપીઓ (૧)સલીમ ઉર્ફે સલીમ ટકલો નુરઅલી ઈરાની ઉ.વ.૪૧ રહે. ઈરાની ગની વોર્ડ નં-૧, શ્રીરામપુર થાના- શ્રીરામપુર સીટી પો.સ્ટે. તા-શ્રી.રામપુર જી-અહમદનગર (મહારાષ્ટ્ર) તથા (૨) રાજ મોહમંદ ફોલાદ ઈરાની ઉ.વ.૩૬. રહે-શ્રીરામપુર રહે. વોર્ડ નં.૦૧, ઈરાની ગલી વોર્ડ નં. ૦૧, શ્રીરામપુર સીટી પો.સ્ટે. તા. શ્રીરામપુર જી-અહમદનગર (મહારાષ્ટ્ર) નાઓને પકડીને સુરત શહેર ખાતે લાવી ઉપરોક્ત એમ.ઓ.થી નોંધાયેલ ગુનાના સમયગાળા દરમ્યાન બનાવ સ્થળના આજુબાજુના કમાન્ડ & કંટ્રોલરૂમના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થયેલ ફોટાઓ આધારે આરોપીઓની પુછપરછ કરતા તેઓએ તથા તેમના સાથીદાર ડંબર શાહજહાન જાફરી રહે. લોની રેલ્વે સ્ટેશન નજીક, ઈરાની બસ્તીમાં પુના (મહારાષ્ટ્ર) તથા જફર મુખતાર ઈરાની રહે-એજન નાઓ સાથે મળી સને:-૨૦૧૫, ૨૦૧૬ તથા ૨૦૧૭ ની સાલમાં સુરત શહેરમાં અડાજણ, ઉમરા, ખટોદરા પો.સ્ટે.માં અલગ અલગ વિસ્તારમાંથી આવતા-જતા લોકો તથા સ્ત્રીઓને અલગ-અલગ બહાના હેઠળ પોલીસ તરીકેનો સ્વાંગ રચી ફરીયાદીઓના શરીર પરથી સોનાના દાગીના ઉતારાવી તે દાગીના બેગ/ થેલી/ પર્સ/રૂમાલમાં તથા કાગળના પડીકામાં મુકવાનો ઢોંગ કરી હાથ ચાલાકીથી નજર ચુકવીને સોનાના દાગીના ઠગાઈ/છેતરપીંડીથી મેળવી હોવાના ગુનાઓ આચરેલ હોવાથી કબુલાત કરેલ છે. જેમાં સુરત શહેર ખાતે નીચે જણાવ્યા મુજબના ગુન્હાઓ નોંધાયેલ છે.

#### ડીટેક્ટ ગુનાઓ

(૧) અડાજણ પો.સ્ટે. । ગુ.ર.નં.૭૪/૨૦૧૫ ઈ.પી.કો. કલમ ૪૦૬,૪૨૦,૧૭૦,૧૧૪ મુજબ (૨) અડાજણ પો.સ્ટે. । ગુ.ર.નં.૧૩૯/૨૦૧૫ ઈ.પી.કો. કલમ ૪૦૬,૪૨૦,૧૭૦,૧૧૪ મુજબ (૩) અડાજણ પો.સ્ટે. । ગુ.ર.નં.૪૧/૨૦૧૬ ઈ.પી.કો.કલમ ૪૦૬,૪૨૦,૧૭૦,૧૧૪ મુજબ (૪) ઉમરા પો.સ્ટે. । ગુ.ર.નં-૧૨૦/૨૦૧૫ ઈ.પી.કો. કલમ ૪૦૬,

૪૨૦,૧૭૦,૧૧૪ મુજબ (૫) ઉમરા પો.સ્ટે. | ગુ.ર.નં.૧૧/૨૦૧૬ ઈ.પી.કો. કલમ ૪૦૬,૪૨૦,૧૭૦,૧૧૪ મુજબ (૬)  
ઉમરા પો.સ્ટે. | ગુ.ર.નં.૧૭૬/૨૦૧૬ ઈ.પી.કો. કલમ ૪૦૬,૪૨૦,૧૭૦,૧૧૪ મુજબ

### આરોપીઓનો ગુનાહીત ઇતિહાસ

(૧) આરોપી સલીમ ઉર્ફે સલીમ ટકલો નુરાલી ઈરાની નાઓ સને ૨૦૦૧-૦૨ માં સંગમનેર જી-અહેમદનગર પો.સ્ટે. માં સને ૨૦૦૨ માં ઓરંગાબાદ ક્રાતી પો.સ્ટે. સને ૨૦૦૫-૦૬ માં નાશીકમાં સને-૨૦૦૯-૧૦ માં પુના કાઈમ બ્રાચમાં-સને ૨૦૧૦-૧૧ માં દિલ્લીમાં ગાંધીપુરમાં બેંકમાં હાથ ચાલાકીથી પૈસા ચોરી કરવાના ગુનાઓમાં પકડાયેલ છે. અને સને-૨૦૧૭ માં નાશીક કાઈમ બ્રાંચમાં નકલી પોલીસ બની સોનાના દાગીના ચીટીંગ કરી મેળવી લેવાના ચાર ગુનામાં પકડાયેલ હોવાની કબુલાત કરેલ છે.

(૨) આરોપી રાજ મોહમંદ ફોલાદ ઈરાની નાઓ સને ૨૦૧૨ માં શ્રીરામપુર શહેર પો.સ્ટે. જી-અહેમદનગર ખાતે નાકોર્ટીક્સ (ચરસ)નો કેસ થયેલ છે સને-૨૦૧૩ માં ઓરંગાબાદમાં ચેઈન સ્નેચીંગના ગુનામાં પકડાયેલ છે. સને - ૨૦૧૭ માં નાશીકમાં નકલી પોલીસ બની સોનાના દાગીના ચીટીંગ કરી મેળવી લેવાના પાંચ ગુનામાં પકડાયેલ છે. સને ૨૦૧૮ ના શરૂઆતમાં નાશીકમાં નકલી પોલીસ બની સોનાના દાગીના ચીટીંગ કરી મેળવી લેવાના એક ગુનામાં પકડાયેલ હોવાથી કબુલાત કરેલ છે.

ઉપરોક્ત ગુનાઓ સિવાય મજકુર આરોપીઓએ સને ૨૦૧૪ થી ૨૦૧૬ ના સમયગાળામાં સુરત શહેરમાં અલગ-અલગ બેંકોમાં લોકો પૈસા કે ભરવા માટે આવે ત્યારે તેમને નોટના નંબર લખવા અંગે, પૈસા ચેક કરી લેવા અંગે, અમુક નોટ ચાલતી નથી, અમુક નોટ ફાટેલી હોય છે. વિગેરે અલગ-અલગ બહાના જણાવી વિશ્વસમાં લઈ નોટો ચેક કરવા મદદ કરવાના બહાને પૈસા હાથમાં લઈ તેમની નજર ચુકવી રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ ના દરની કેટલીક નોટો કાઢી લઈ, ચીટીંગ કરેલ હોવાના ગુનાઓ આચરેલ હોવાની પણ કબુલાત કરેલ છે. આ ગુનાઓ તેઓએ પોતાના વતન મહારાષ્ટ્ર, શ્રીરામપુર, નાશીક, ઓરંગાબાદ, નવસારી, સુરત શહેર, અંકલેશ્વર, અમદાવાદ, હિમ્મતનગર, ગોધરા, રતલામ, ઈન્દોર, રાજપીપળા, જયપુર, દિલ્લી વિગેરે શહેરોમાં જઈ ગુનાઓ આચરેલ હોવાની કબુલાત કરેલ છે.